

K.Z. LEASING & FINANCE LTD.

REGD. OFFICE : DESHNA CHAMBERS, H/H. KADVA PATIDAR VADI, USMANPURA,
ASHRAM ROAD, AHMEDABAD-380014.(GUJARAT) PHONE : 079-27543200
CIN L 65910 GJ 1986 PLC 008864

01st February, 2021.

To,
The Deputy Manager,
Department of Corporate Services,
Bombay Stock Exchange Limited
Dalal Street, Fort
Mumbai - 400 001.

BSE Company Code: 511728

Dear Sir,

Sub.: Compliance under Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015.

As per the reference above, we hereby submit you the Newspaper copy of the Notice of Unaudited Financial results for the quarter ended on 31.12.2020, as published in the Newspaper in English as well as Gujarati.

Kindly take note of the same.

Thanking you,

Yours Faithfully,

For, K Z LEASING AND FINANCE LIMITED

Pravinkumar Patel
Managing Director
(Din: 00841628)



Telangana gets additional Rs 179 cr for capex

New Delhi,
The Finance Ministry has approved capital projects of an additional amount of Rs 179 crore for Telangana. This is in addition to the capital projects of Rs 179 crore approved for the state earlier.

Additional projects have been approved in the state as an incentive for undertaking reforms in three out of the four stipulated citizen-centric areas, i.e. One Nation One Policy, Ease of Doing Business and Urban Local Bodies Reforms. The projects have been approved under the newly-launched scheme of 'Financial Assistance to States for capital projects'.

Telangana has become the second state to get additional funds under the scheme. Earlier, Madhya Pradesh was sanctioned ad-

ditional capital projects of Rs 660 crore as an incentive for undertaking reforms in three out of four stipulated areas.

The citizen-centric areas identified by the government for undertaking reforms by the states are:

- One Nation One Policy, Ease of Doing Business, power sector reforms and Urban Local Bodies reforms.

Out of the total additional approved amount of Rs 179 crore, an amount of Rs 89.50 crore has been released to the state as first instalment. All the capital projects identified by the state government of Telangana to be taken up from the additional funds are in the road sector.

The scheme of Special Assistance to States for capital expenditure was an-

nounced by the Finance Minister on October 12, 2020 as part of Aatmanirbhar Bharat package.

The scheme is aimed at boosting the economy through reforms by the state governments who are facing difficult financial environment this year due to the shortfall in tax revenue arising from the COVID-19 pandemic.

Capital expenditure has a higher priority in the budget, enhancing the future productive capacity of the economy, and results in a higher rate of economic growth.

Therefore, despite the additional financial package of the central government, it was decided to extend special assistance to the state governments in respect of capital expenditure in financial year 2020-21.

Though firm global

Hike in fuel prices hit pause for 3rd day

New Delhi,

Pause on price hike of petrol and diesel continued on Saturday for the third day in a row after rising consecutively on Tuesday and Wednesday, increasing pump prices for both auto fuels by 60 paisa per litre in Delhi.

With price on hold, petrol continued to be available at a record high of Rs 86.30 a litre in Delhi while diesel was at Rs 74.48 per litre.

Across the country as well the fuel prices remained at Wednesday's level. In Mumbai, petrol is priced at Rs 92.86 a litre while in Chennai, Rs 88.90; in Kolkata, Rs 76.69. Diesel on the other hand is at Rs 83.30 a litre in Mumbai, Rs 81.71 in Chennai and Rs 80.08 in Kolkata.

Crude oil prices have remained flat for last few weeks in wake of unilateral production cuts announced by Saudi Arabia and a pick up in consumption in all major economies.

The petrol and diesel prices have increased 10 times in January with both auto fuels increasing by Rs 2.59 and Rs 2.61 per litre respectively during the month. The last few in-

creases in pump prices in petrol and diesel has taken price to record levels across the country in all major metro cities and other towns and cities. The total price of auto fuels were closer to current levels on October 4, 2018 when crude prices had shot up by \$80 a barrel.

The current price rise is largely on account of steep increases in taxes of petrol and diesel and firm crude prices.

Petrol price was very close to breaching the all-time high level of Rs 84 a litre, recorded on October 4, 2018 when it reached its peak in December 2018.

Crude price has remained flat for last few weeks in wake of unilateral production cuts announced by Saudi Arabia and a pick up in consumption in all major economies.

The petrol and diesel prices have increased 10 times in January with both auto fuels increasing by Rs 2.59 and Rs 2.61 per litre respectively during the month. The last few in-

EXTENSION OF RUNNING PERIOD FOR 6 PAIRS OF SPECIAL TRAINS

Western Railway has decided to extend the run of following 6 pairs of special trains, which will originate/terminate over Western Railway as per details given below:

TRAIN NO.	ORIGINATING STATION & DESTINATION	EXTENSION FROM TO
09271 (on Mon)	Bandra Terminus - Patna Jn. (Superfast Weekly Special)	01.02.21 to 26.04.21
09272 (on Wed)	Patna Jn. - Bandra Terminus (Superfast Weekly Special)	03.02.21 to 28.04.21
02913 (on Sun)	Bandra Terminus - Saharsa (Superfast Weekly Special)	07.02.21 to 25.04.21
02914 (on Tue)	Saharsa - Bandra Terminus (Superfast Weekly Special)	09.02.21 to 27.04.21
02929 (on Fri)	Bandra Terminus - Jaislamer (Superfast Weekly Special)	05.02.21 to 30.04.21
02930 (on Sat)	Jaislamer - Bandra Terminus (Superfast Weekly Special)	06.02.21 to 01.05.21
09027 (on Sat)	Bandra Terminus - Jammu Tawi (Weekly Special)	06.02.21 to 24.04.21
09028 (on Mon)	Jammu Tawi - Bandra Terminus (Weekly Special)	08.02.21 to 26.04.21
09017 (on Wed)	Bandra Terminus - Hardwar (Superfast Weekly Special)	03.02.21 to 28.04.21
09018 (on Thur)	Hardwar - Bandra Terminus (Superfast Weekly Special)	04.02.21 to 29.04.21
09424 (on Mon)	Gandhidham - Tirunelveli (Superfast Weekly Special)	01.02.21 to 26.04.21
09423 (on Thur)	Tirunelveli - Gandhidham (Superfast Weekly Special)	04.02.21 to 29.04.21

Booking of Train Nos. 09271, 09017 & 09424 will open from 31st January, 2021. For Train No. 02929

will open from 1st February, 2021 and for Train Nos. 02913 & 09027 will open from 2nd February, 2021 at nominated PRS counters and on IRCTC website. Above trains will run as fully reserved trains on special fare.

For detailed timings of the halts of respective special trains, please visit www.enquiry.indianrail.gov.in

• Only passengers having confirmed tickets will be permitted to board these special trains.

• Passengers are advised to adhere all norms, SOPs related to COVID-19 during the boarding, travel and at destination.

 **WESTERN RAILWAY** www.wr.indianrailways.gov.in

Like us on:  [facebook.com/WesternRail](#)
Follow us on:  [twitter.com/WesternRail](#)

Please Carry ID Proof for all reserved tickets

LG ranks 2nd in telematics control unit market in 2020

Seoul, LG Electronics was the world's second-largest supplier of telematics control units (TCU) in 2020, reported showed, as the South Korean tech giant eyes to expand its presence in the

market.

LG Electronics accounted for 10 percent of the global TCU shipments in 2020, to rank second behind Continental AG with a 20.3 percent market share, according to market re-

porters.

LG's 2020 market share was 10 percent in 2018, when it topped the global TCU sector after beating Continental with an 18 percent share, reports Yonhap news

searcher Counterpoint Research.

"LG's market share is declining due to heavy dependence on tier one players (GM), which has reached a saturation point in terms of TCU penetration," said Amnon Madhok, a senior analyst at Counterpoint Research.

"During the last few years, GM has taken LG in terms of market share due to new contracts and the increasing penetration of TCUs in mass-produced vehicles."

"LG's market share is declining due to heavy dependence on tier one players (GM), which has reached a saturation point in terms of TCU penetration," said Amnon Madhok, a senior analyst at Counterpoint Research.

"During the last few years, GM has taken LG in terms of market share due to new contracts and the increasing penetration of TCUs in mass-produced vehicles."

"The FAA will continue to work with SpaceX to evaluate additional information provided by the company as part of its application to modify its launch license," FAA spokesperson Steve Kouros said.

"We will approve the modification only after we are satisfied that SpaceX has taken the necessary steps to comply with regulatory requirements."

A prototype of Elon Musk's aerospace company SpaceX's next-generation heavy-lift rocket completed a test flight on landing after a high-altitude flight in Texas.

The launch and ascent of Starship serial number 8 (SN8) were successful, but as the engines appeared to reignite for landing, the vehicle flipped back to vertical and then slammed into the ground.

Company SpaceX's next-generation heavy-lift rocket completed a test flight on landing after a high-altitude flight in Texas.

The launch and ascent of Starship serial number 8 (SN8) were successful, but as the engines appeared to reignite for landing, the vehicle flipped back to vertical and then slammed into the ground.

The US Federal Aviation Administration (FAA) is probing SpaceX's Starship test that exploded in Dec

2020.

Notice of BOARD MEETING

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015, the meeting of Board of Directors of the Company is scheduled to be held on Friday, 12th February, 2021 interalia, to consider and approve the Unaudited Financial Results of the Company for the quarter and Nine Months ended 31st December, 2020. This information is also available at the website of the company and website of the Stock exchange at www.seindia.com.

For Ceejay Finance Limited

Sd/-
Shalabh Bharvad
Company Secretary

CEEJAY FINANCE LIMITED

CIN:L65910GJ1994PLC01265

House, Mata Pore, Nadia-701101, West Bengal, India.

Website: www.ceejaygroup.com

E-Mail: sales@heebsbhavard.com

Date : 30th January, 2021

Place : Nadiad

The US Federal Aviation Administration (FAA) is probing SpaceX's Starship test that exploded in Dec

2020.

Notice of BOARD MEETING

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015, the meeting of Board of Directors of the Company is scheduled to be held on Friday, 12th February, 2021 interalia, to consider and approve the Unaudited Financial Results of the Company for the quarter and Nine Months ended 31st December, 2020. This information is also available at the website of the company and website of the Stock exchange at www.seindia.com.

For N.W.R.W.S. & Kalpsar Department, Gandhinagar

Sd/-
Shailesh Bhavard
Company Secretary

N.W.R.W.S. & Kalpsar Department, Gandhinagar

Tender Notice No. 14 of 2020-21

(Correction)

The following works tenders are invited by the "Executive Engineer, Surendranagar Irrigation Division, Surendranagar" by way of line E-tendering system. The last date for submission of tenders is amended as follows.

Sr. No. Particular Estimated Amount Rs. Rs. Ps.

1 Dhar Irrigation Scheme 239=83

Constructing canal system by Converting existing flow canal system into cutting canal system of Dhar Irrigation Scheme (incl. excavation, lining, etc.) at Tal Cholla, Dist: Surendranagar

Notice of the EE :-

(1) The Executive Engineer, Surendranagar Irrigation

Division, Bahuvali bhavan, Room No. 208, Second Floor, Block No. A, Kherali Road, Post- Jarovarmagar,

Gujarat State (37252) 282920

(2) Further details can be obtained at www.state.tenders.com & www.nwrprocure.com and notice board of this office

Last date & time of submission of on line bid - up to date 16.02.2021 up to 18.00 hours IST only on Web site www.nwrprocure.com. Any changes to the tender will be seen on-line.

Notes:-

The above results are extract of the detailed format of financial results for the quarter and nine months ended December 31, 2020 filed with the stock exchange pursuant to regulation 33 of the SEBI (Listed Obligations and Disclosure Requirements) regulations, 2015. The form of the unadjusted financial results is available on the stock exchange websites www.bseindia.com and www.nseindia.com. The results have been reviewed and recommended by the audit committee at its meeting held on January 29, 2021 and approved by the board of directors at its meeting held on January 29, 2021. The financial results as per Indian accounting standards and relevant amendment rules thereunder, the current quarter and nine months ended December 31, 2020 results have been subjected to a limited review by the statutory auditor of the company.

The consolidated financial statement has been prepared in accordance with Indian Accounting Standards Ind AS-10 "Consolidated Financial Statement", Consolidated financial results of the company include the financial results of wholly owned subsidiaries, ADF Foods (India) Limited and its step-down subsidiaries viz ADF Holdings (USA) Inc.

Other income and other expenses above includes net foreign exchange gain and loss respectively for each reporting period as under:

Rs. in Lakhs

Particulars Quarter ended 31-12-2020 Quarter ended 30-9-2020 Quarter ended 31-12-2019 Quarter ended 30-9-2019

Standalone Year to date for previous year ended 31-12-2020 Previous year ended 31-12-2019 Consolidated Year to date for previous year ended 31-12-2020 Previous year ended 31-12-2019

(Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited)

Total Income from operations (net) 6,833.55 6,066.14 4,878.54 16,605.23

Net Profit / (Loss) for the period before Tax, Exceptional and Extraordinary items 1,443.95 1,191.80 756.08 3,005.95

Net Profit / (Loss) for the period before tax (after Exceptional and Extraordinary items) 1,443.95 1,191.80 764.01 3,200.61

Net Profit / (Loss) for the period after tax (after Exceptional and Extraordinary items) 1,083.25 871.17 811.12 2,372.28

Total comprehensive income for the period after tax (after Exceptional and Extraordinary items) 1,039.57 997.65 612.89 2,553.25

Comprehensive loss for the period after tax (after Exceptional and Extraordinary items) 1,039.57 997.65 612.89 2,553.25

Equity Share Capital 2,002.27 2,002.27 2,002.27 2,002.27

Face value of equity share 2,002.27 2,002.27 2,002.27 2,002.27

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,41 4.35 4.05 11.85

Equity Share Capital 5,41 4.35 4.05 11.85

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,41 4.35 4.05 11.85

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

Reserves (excluding Revaluation Reserves as at Balance Sheet Date) 5,26 4.35 4.05 11.53

Equity Share Capital 5,26 4.35 4.05 11.53

